

## FAQ

1. Only Gujarat State Government employees are eligible for this exam.

માત્ર ગુજરાત સરકારના કર્મચારીઓ જ આ પરીક્ષા માટે લાયક છે.

2. Login is to be created by using applicant's mobile number as user name & applicant has to choose their own password. An OTP will be sent on the mobile no which is to be entered to complete registration process. All the communication by SMS will be sent to the candidate on this mobile number. **Password should be without any special character.**

અરજદારના મોબાઇલ નંબરનો યુઝર નેમ તરીકે ઉપયોગ કરીને લોગ-ઇન બનાવવામાં આવશે અને અરજદારે તેમનો પોતાનો પાસવર્ડ પસંદ કરવાનો રહેશે. અરજદારના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી છે. SMS દ્વારા ઉમેદવારને તમામ કમ્યુનિકેશન આ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. **પાસવર્ડ કોઇ પણ સ્પેશિયલ કેરેક્ટર વગરનો હોવો જોઇએ.**

3. Application fee to be paid online using debit cards, credit cards or net banking. **Registration fee paid is "Non Refundable" and "Non Transferrable". Fee once paid will not be refunded under any circumstances.**

એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ઓનલાઇન ચુકવવાની રહેશે. **ચુકવેલી રજિસ્ટ્રેશન ફી "નોન રિફંડેબલ" અને "નોન ટ્રાન્સફરેબલ" છે. ચુકવેલી ફી કોઇ પણ સંજોગોમાં રિફંડ કરવામાં આવશે નહીં.**

4. **No hard copy of the registration form is to be sent to university. The print out of your form is to be attested by your department head on page no 2. This print out along with Xerox copy your service certificate & photo ID is to be submitted at the time of examination. Original photo ID is to be produced at the time of examination for verification.**

યુનિવર્સિટીને રજિસ્ટ્રેશન ફોર્મની કોઇ પણ હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. તમારા ફોર્મની પ્રિન્ટ આઉટને તમારા વિભાગીય વડા દ્વારા પેજ નંબર 2 પર એટેસ્ટ કરાવવાની રહેશે. પરીક્ષા વખતે આ પ્રિન્ટ આઉટ અને તમારા સર્વિસ સર્ટિફિકેટ અને ફોટો ઓળખપત્રની ઝેરોક્ષ કોપી જમા કરાવવાની રહેશે. પરીક્ષા વખતે ખરાઈ કરવા માટે મૂળ ફોટો ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.

5. Applicant has to load his photo & signature at the time of filling of form.

અરજદારે ફોર્મ ભરતી વખતે તેનો ફોટો અને સહી અપલોડ કરવા જરૂરી છે.

6. Application can be submitted for any exam Theory and practical both or only theory or only practical. Applicant who has passed in theory paper can appear for practical exam only. Similarly applicant who has passed in practical examination previously can appear for theory examination only.

અરજી કોઇ પણ પરીક્ષા માટે કરી શકાય છે થિયરી અને પ્રેક્ટિકલ બંને અથવા માત્ર થિયરી અથવા માત્ર પ્રેક્ટિકલ. થિયરીના પેપરમાં પાસ થયેલો અરજદાર જ માત્ર પ્રેક્ટિકલની પરીક્ષા આપી શકે છે. તેવી જ રીતે અગાઉ પ્રેક્ટિકલની પરીક્ષામાં પાસ થયેલો અરજદાર માત્ર થિયરીની પરીક્ષા આપી શકે છે.

7. Applicant is allowed to change the information filled in the application form except their

name & type of examination by submitting "Form Edit Request" through his respective login.

અરજદારને અરજીપત્રકમાં ભરેલી વિગતોમાં ફેરફાર કરવાની પરવાનગી છે સિવાય કે તેમના નામ અને પરીક્ષાનો પ્રકાર. અરજદાર તેના લોગ-ઇનમાંથી "ફોર્મ એડિટ રિક્વેસ્ટ" ("Form Edit Request") જમા કરાવીને આ ફેરફાર કરી શકે છે.

8. In case you forget password, it can be retrieved from the system by entering your login name & clicking "**Forgot Password**"

તમે પાસવર્ડ ભૂલી ગયા હો તેવા કિસ્સામાં, તમે તમારું લોગ-ઇન નામ એન્ટર કરીને "**ફરગોટ પાસવર્ડ**" ("**Forgot Password**") પર ક્લિક કરીને સિસ્ટમમાંથી પાસવર્ડ પાછો મેળવી શકો છો.

9. The schedule for the examination as well as other important notifications will be informed by SMS on registered mobile no used at the time of registration. It will be displayed on university website also. Candidates are requested to visit university for regular updates.

પરીક્ષાના કાર્યક્રમ તેમજ અન્ય મહત્વની જાહેરાતો રજિસ્ટ્રેશન વખતે ઉપયોગમાં લેવામાં આવેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS મારફતે જાણ કરવામાં આવશે. ઉમેદવારોને નિયમિત નવી માહિતી મેળવવા માટે યુનિવર્સિટીની મુલાકાત લેવાની વિનંતી કરવામાં આવે છે.

10. Candidates are requested to appear for the exam, on the stipulated date & time. Candidates not appearing for the exam, would be marked as "**ABSENT**". **No change in date or time of examination is permitted under any circumstances.**

ઉમેદવારોને નિર્ધારિત તારીખે અને સમયે પરીક્ષા આપવા માટે વિનંતી કરવામાં આવે છે. પરીક્ષા નહીં આપી રહેલા ઉમેદવારને "**ગેરહાજર**" ગણવામાં આવશે. કોઇ પણ સંજોગોમાં પરીક્ષાના તારીખ કે સમયમાં ફેરફારની પરવાનગી આપવામાં આવશે નહીં.